

તાત્કાલિક પ્રકાશન માટે

## બ્રેમ્પટને નવા ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની (મુખ્ય વહીવટી અધિકારીની) ઘોષણા કરી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 18, 2019) – બ્રેમ્પટન સીટી કાઉન્સિલને ડેવિડ બારિક (David Barrick) ની શહેરના નવા ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (CAO) તરીકે સર્વાનુમતે નિયુક્તિની જાહેરાત કરતા ખુશી થાય છે.

શ્રીમાન બારિક (Mr. Barrick) નાયગ્રા પેનિન્સુલા કન્ઝર્વેશન ઓથોરિટીમાં ડાયરેક્ટર, કોર્પોરેટ સર્વિસીસ અને કાર્યકારી CAO સહિતનો ખાનગી અને જાહેર ક્ષેત્રનો મિશ્રિત અનુભવ મેળવીને સીટી ઓફ બ્રેમ્પટનમાં જોડાયા છે.

શ્રીમાન બારિક (Mr. Barrick) આ શહેરમાં પોતાની ફરજો ઓક્ટોબર 23, 2019 થી શરૂ કરશે.

સીટી કાઉન્સિલે પોતાની ઓગસ્ટ 7, 2019 ની બેઠકમાં, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રિક્રુટમેન્ટ કમિટી બનાવી. આ કમિટીના અધ્યક્ષ મેયર બ્રાઉન (Mayor Brown) હતા અને આ સમિતિ કાઉન્સિલના તમામ સભ્યોની બનેલી હતી.

આ શહેરે આ નોંધપાત્ર આગેવાની સ્થિતિ માટે ભરતી કરવા રાષ્ટ્રીય વહીવટકર્તા શોધ પેઢી (નેશનલ એક્ઝિક્યુટિવ સર્ચ ફર્મ) ડેક્સન પાર્ટનર્સને રોકી હતી. ફેલ્ડમેન ડેક્સન પાર્ટનર્સ (Feldman Daxon Partners) કેનેડામાં સૌથી જૂની રાષ્ટ્રીય સ્તરે વહીવટકર્તા શોધ સેવાઓ પૂરી પાડનાર પેઢી છે. આ સમિતિની ભૂમિકા ભરતી પ્રક્રિયા સરળ બનાવવાની અને કાઉન્સિલ સભ્યોને સંબંધિત ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવાની તક આપવાની હતી.

### અવતરણો (ક્વોટ્સ):

“મને બ્રેમ્પટનના નવા મુખ્ય વહીવટી અધિકારી તરીકે ડેવિડ બારિક (David Barrick) ને આવકારવામાં ખુશી થાય છે. આપણી કાઉન્સિલ અગ્રતાઓ હાસલ કરે ત્યારે આપણી નવી કાઉન્સિલ કરો (ટેક્સીસ) ઓછા રાખવા અને સમુદાયની સુરક્ષા સુધારવી જેવી સમુદાયની અગ્રતાઓને સંબોધવા ઝડપથી આગળ વધી છે. અમે વ્યવહારુ અનુભવ અને સમજ ધરાવતા ઉમેદવારની શોધમાં હતા, જે આ કાઉન્સિલની ઊર્જા સાથે સુમેળ સાધી શકે અને કાર્યક્ષમતાઓ અને જાહેર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા ચાલુ રાખતી વખતે જવાબદાર જાહેર સેવાઓ પૂરી પાડી શકે.. મને વિશ્વાસ છે કે શ્રીમાન બારિક (Mr. Barrick) અસરકારક રીતે આપણાં સીટી કર્મચારીગણની આગેવાની કરશે અને ખાતરી કરાવશે કે આપણે તમામ બ્રેમ્પટન રહેવાસીઓ માટે સુરક્ષિત અને ગતિશીલ શહેર જવાબદારીપૂર્વક બનાવવાનું ચાલુ રાખીએ છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**मिडिया संपर्क:**

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अेन्ड कम्युनिटी अेंगेजमेन्ट

व्यूडाल्मक संवाड

सीटी ओफ् ब्रैम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)